



THE ADMISSION COMMITTEE FOR PROFESSIONAL COURSES (GUJARAT STATE)

Formed under Section 9(1) of the Gujarat Professional Technical Educational Colleges or Institutions (Regulation of Admission and Fixation of Fees) Act, 2007

ACPC/Awar.Prog/2018/326

Date : 12-04-2018

પ્રતિ;
આચાર્ય શ્રી,
તમામ સ્વનિર્ભર સંસ્થાઓ

તા: ૧૧-૪-૨૦૧૮ ના રોજ ચેરમેનશ્રી, એસીપીસી સાથે થયેલ ચર્ચા મુજબ સ્વનિર્ભર સંસ્થાઓના એડમીશન કમીટી ફોર પ્રોફેશનલ કોર્સિસ, અમદાવાદ ના સહયોગથી યોજવાના થતા અવેરનેશ પ્રોગ્રામ ૨૦૧૮ ના અનુસંધાને નીચે મુજબ ની માર્ગદર્શિકા મંજૂર કરેલ છે.

માર્ગદર્શિકા

જે સ્વનિર્ભર સંસ્થાઓ એસીપીસી ના સહયોગ થી એડમીશન વર્ષ ૨૦૧૮ અંતર્ગત વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ પછીના ડિગ્રી ઈજનેરી, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી તથા બેચલર ઓફ આર્કિટેક્ચર અભ્યાસક્રમ ના એડમીશન અંગેની માહિતી તથા માર્ગદર્શન આપવાના હેતુ થી અવેરનેશ પ્રોગ્રામ નું આયોજન કરવા ઈચ્છા ધરાવતી હોય તેઓએ નીચે મુજબ ની માર્ગદર્શિકા નું પાલન કરવાનું રહેશે.

- ૧) આ પ્રોગ્રામ અંગેની જાહેરાત એસીપીસી દ્વારા નક્કી કરવામાં આવેલ નમુનામાં જ આપવાની રહેશે તથા આ જાહેરાત ની કોપી એસીપીસી ને અગાઉ થી જાણ સારુ મોકલવાની રહેશે. (જાહેરાત નો નમુનો આ સાથે જોડેલ છે)
- ૨) જે તે સંસ્થાએ આવા પ્રોગ્રામ નું આયોજન તેમની સંસ્થા ના જીલ્લા વિસ્તાર માં કરવાનું રહેશે.
- ૩) એસીપીસીના સહયોગથી જે તે સંસ્થા ને વધુ માં વધુ બે પ્રોગ્રામ ના આયોજન ની મંજૂરી આપવામાં આવશે.
- ૪) આ પ્રોગ્રામ ના સમય તથા સ્થળ ની જાણકારી એસીપીસી કચેરી ને ઓછા માં ઓછા ૦૪ દિવસ અગાઉ કરવાની રહેશે, કે જેથી અધિકારી ની નિયુક્તિ કરી શકાય.
- ૫) આ પ્રોગ્રામ માં એસીપીસી ના અધિકારી દ્વારા એસીપીસી દ્વારા નિયત કરવામાં આવેલ માહિતી-પ્રેઝન્ટેશન તથા એડમીશન લગતા પ્રશ્નોના નિરાકરણ ની સમજ આપવામાં આવશે. પ્રોગ્રામ આયોજક સંસ્થા અંગેની કોઈ જ માહિતી એસીપીસી દ્વારા નિયુક્ત કરેલ અધિકારી આપશે નહિ.
- ૬) આ પ્રોગ્રામ અંતર્ગત આયોજક સંસ્થા તરફથી આપવામાં આવેલ માહિતી ની યથાર્થતા તથા કાયદેસરતા બાબતે એસીપીસી કોઈ જ રીતે જવાબદાર રહેશે નહિ.
- ૭) આ આયોજન અંગેનો તમામ પત્ર વ્યવહાર awareness.acpc@gmail.com ઉપર કરવાનો રહેશે.

મેમ્બર સેક્રેટરી

બિડાણ : જાહેરાત નો નમુનો